

સુરક્ષિત બોટિંગ માટે 10 સૂચનાઓ

દર વર્ષે અંદાજે 140 કેનેડિયનો બોટિંગની ઘટનાઓમાં ડૂબી જતાં હોય છે. તેમાં પુરૂષોનું પ્રમાણ 80 ટકાથી વધુ હોય છે. 90 ટકાથી વધુ પુરૂષો લાઇફજેકેટસ પહેરતા જ નથી. માર્ગ પર તમે તમારી સીટ બેલ્ટ પહેરી રાખો છો કારણ કે તમે જાણો છો કે અકસ્માતમાં તેને પહેરવાનો તમારી પાસે સમય નહીં રહે. જળમાર્ગ પર તમારી લાઇફજેકેટ વિશે એ જ રીતે વિચારો. તમે તેને નહીં પહેરો તો તે તમને કામમાં નહીં આવે.

સુરક્ષિત બોટિંગ માટે ટોચની સૂચનાઓ :

1. ઠંડુ પાણી તમે ધારો તેના કરતાં વધુ ઘાતક હોય છે. ઠંડા પાણીનો આઘાત ઝીલવા તૈયાર રહો -હંમેશાં લાઇફજેકેટ પહેરો.
2. શરાબ અને બોટિંગનો કોઈ મેળ બેસતો નથી. શરાબને કિનારે જ છોડી દો.
3. હવામાનની આગાહી ચકાસી લો. જો ખરાબ હવામાનનો અણસાર આવે તો તાત્કાલિક કિનારે પાછા ફરો.
4. હાઈડ્રોઈલેક્ટ્રિક સ્ટેશનો અને બંધોની આસપાસ આવેલા ચેતવણીના તમામ સંકેતો અને બોયાંને અનુસરો; પાણીનાં શાંત વહેણ જોતજોતામાં જબરદસ્ત ધોધ બની શકે છે. માટે જ “દૂર રહો, સુરક્ષિત રહો”.
5. પાવરબોટસ જવાબદારીપૂર્વક ચલાવો - ખાસ કરીને જ્યારે પાણી અસ્થિર હોય ત્યારે યોગ્ય ગતિ અપનાવો.
6. બેસી રહો! નાની પાવરબોટ, કેનો અથવા કયાકમાંથી તમે આસાનીથી બહાર પડી શકો છો.
7. તૈયાર રહો. ખાતરી કરો કે તમારા વહાણ પર જરૂરી સુરક્ષા ઉપકરણો અને પૂરતું ઈંધણ છે.
8. જ્યારે તમે પાણી પર હો ત્યારે VHF રેડિયો અથવા સેલ ફોન તમારી સાથે રાખો.
9. હંમેશાં કોઈને કહીને જાવ કે તમે ક્યાં જાઓ છો અને ક્યારે પાછા ફરશો.
10. તાલીમ લો. પાણીમાં અનપેક્ષિતપણે પડયા પછી કેવી રીતે બચવું તે શીખો.

લાઇફસેવિંગ સોસાયટી અને ઓન્ટારિયો પાવર જનરેશનના સૌજન્યથી આપના માટે બોટિંગ અંગે સુરક્ષા સૂચનાઓ. વધુ માહિતી માટે www.lifesavingsociety.com પર જાઓ.